



BBC-004-014111-014112-014113 Seat No. _____

B. Ed. (Sem. I) Examination

July - 2021

EC-09 : Accounting Method

EC-10 : Economics Method

EC-11 : Business Management &

Administration Method

(New Course)

Time : 1.15 Hours]

[Total Marks : 35

Faculty Code : 004

Subject Code : 014111 / 014112 / 014113

EC-09 : Accounting Method

1 નીચે આપેલા ૨૦ બહુવિકલ્પી પ્રશ્નો પૈકી કોઈપણ ૧૦ ઉત્તર આપો : ૧૫

(પ્રત્યેકનો ૧.૫ માર્ક)

(૧) નામામાં કયા પ્રકારના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે ?

- (A) બિનઆર્થિક (B) આર્થિક
(C) (A) અને (B) બંને (D) એકપણ નહીં

(૨) નામું લખવાના સોપાનો ક્રમબદ્ધ કરો.

- (1) કાયું સરવૈયું
(2) વાઉચર પરથી આમનોંધ
(3) વાર્ષિક હિસાબો
(4) ખાતાવહી-ખતવણી
(A) (૨), (૪), (૩), (૧) (B) (૨), (૩), (૪), (૧)
(C) (૨), (૪), (૧), (૩) (D) (૨), (૧), (૩), (૪)

(૩) શાની શોધ થવાથી વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદાઓ દૂર થઈ હતી ?

- (A) નામાની (B) નાણાંની
(C) હિસાબોની (D) ખેતીની

(૪) કયા હેતુઓ એક તાસના અંતે સિદ્ધ થઈ શકે તેવા હોય છે ?

- (A) વિશિષ્ટ (B) સામાન્ય
(C) (A) અને (B) બંને (D) એકપણ નહીં

(૫) “વિદ્યાર્થીઓ ચોક્કસાઈપૂર્વક રોકડમેળ તૈયાર કરે” - આ કયો હેતુ છે ?

- (A) જ્ઞાન (B) સમજ
(C) ઉપયોજન (D) કૌશલ્ય

- (દ) માઈક્રોટીચીંગમાં શિક્ષણ (Teach) પછી ક્યું સોપાન આવે છે ?
 (A) પુનઃશિક્ષણ (B) પ્રતિપોષણ
 (C) પુનઃઆયોજન (D) મૂલ્યાંકન
- (૭) નીચેનામાંથી ક્યું લક્ષણ સારા પ્રશ્નનું છે ?
 (A) ટૂંકો અને સ્પષ્ટ
 (B) પૂરતું લંબાણ ધરાવતું
 (C) ઓછામાં ઓછા પંદર શબ્દો ધરાવતો
 (D) એક કરતાં વધારે ઉત્તરો મળે એવો
- (૮) શિક્ષકે કા.પા. કાર્ય ક્યારે કરવું જોઈએ ?
 (A) તાસ પૂર્ણ થવાની પાંચ મિનિટ પહેલા
 (B) પાઠ વિકાસની સાથે સાથે
 (C) તાસના પ્રારંભે
 (D) ગમે ત્યારે
- (૯) સેતુ પાઠ કેટલી મિનિટનો હોય છે ?
 (A) ૫ થી ૧૦ (B) ૧૫ થી ૨૦
 (C) ૩૫ થી ૪૦ (D) ૧૦ થી ૧૫
- (૧૦) કયા પાઠમાં વિવિધ કૌશલ્યોનો સંકલિત ઉપયોગ થાય છે ?
 (A) સેતુપાઠ (B) માઈક્રોપાઠ
 (C) છૂટાપાઠ (D) એકમપાઠ
- (૧૧) પ્રકલ્પ પદ્ધતિના પ્રણેતા કોણ હતા ?
 (A) સોક્રેટીસ (B) હર્બર્ટ
 (C) કિલપેટ્રીક (D) મેસ્લો
- (૧૨) સ્વાધ્યાયના પ્રશ્નો વ્યાકરણની દૃષ્ટિએ કેવા હોવા જોઈએ ?
 (A) સ્પષ્ટ (B) ટૂંકા
 (C) (A) અને (B) બંને (D) એકપણ નહીં
- (૧૩) “અમૂર્તથી મૂર્ત”નો ખ્યાલ કઈ પદ્ધતિમાં છે ?
 (A) આગમન (B) પ્રોજેક્ટ
 (C) સ્વાધ્યાય (D) નિગમન
- (૧૪) સમસ્યા ઉકેલ પદ્ધતિમાં કેન્દ્રસ્થાને શું હોય છે ?
 (A) શિક્ષક (B) સમાજ
 (C) સમસ્યા (D) આચાર્ય
- (૧૫) કયા શબ્દનો અર્થ સમસ્યાનું વિભાજન કરવું એવો થાય છે ?
 (A) સંયોગીકરણ (B) આગમન
 (C) નિગમન (D) પૃથક્કરણ
- (૧૬) શૈક્ષણિક ઉપકરણનું મહત્ત્વ શું છે ?
 (A) શિક્ષણમાં નવીનતા લાવવા
 (B) અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપે રજૂ કરવા
 (C) શિક્ષણ પ્રક્રિયાને રસદાયી બનાવવા
 (D) આપેલ તમામ

- (૧૭) ફિલ્મ સ્ટ્રીપમાં ચિત્રોની પહોળાઈ કેટલી હોય છે ?
 (A) 10 mm. (B) 35 mm.
 (C) 10 cm. (D) 50 cm.
- (૧૮) વર્તમાન સમયનું સૌથી અસરકારક સમૂહ માધ્યમ કયું છે ?
 (A) ટેપરેકોર્ડર (B) દૂરદર્શન
 (C) રેડિયો (D) ફિલ્મ સ્ટ્રીપ
- (૧૯) ચાર્ટ્સ કયા પ્રકારનું શૈક્ષણિક સાધન છે ?
 (A) શ્રાવ્ય (B) દૃશ્ય
 (C) દૃશ્ય-શ્રાવ્ય (D) એકપણ નહીં
- (૨૦) નામું વિષય શિક્ષણમાં ઉપયોગી સામયિક કયું છે ?
 (A) અર્થ સંકલન (B) ટેક્ષ વ્યાપાર
 (C) આર્થિક વિકાસ (D) તમામ

- ૨ નીચે આપેલા આઠ પ્રશ્નો પૈકી કોઈ પણ ચાર ના ઉત્તર આપો : ૨૦
 (પ્રત્યેકના ૫ માર્ક્સ)
- (૨.૧) ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ નામાનાં અધ્યાપનનું મહત્ત્વ દર્શાવો.
 (૨.૨) ધ્યેયની સંકલ્પના જણાવી, ‘‘નામું’’ વિષય શિક્ષણના ધ્યેયો સમજાવો.
 (૨.૩) માઈક્રોપાઠની સંકલ્પના જણાવો. કા.પા. કાર્ય કૌશલ્યનો માઈક્રોપાઠ તૈયાર કરો.
 (૨.૪) સેતુપાઠની સંકલ્પના આપી, માઈક્રોટીચીંગ - સેતુપાઠ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
 (૨.૫) પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો સમજાવો.
 (૨.૬) સ્વાધ્યાય પદ્ધતિનો અર્થ આપી, લાભાલાભ જણાવો.
 (૨.૭) શૈક્ષણિક સાધન તરીકે ચાર્ટ અને સંદર્ભ પુસ્તકોનું મહત્ત્વ સમજાવો.
 (૨.૮) ફિલ્મ સ્ટ્રીપની સંકલ્પના આપો. તેના ઉપયોગ માટે કઈ પૂર્વ તૈયારી કરવી જોઈએ ?

ENGLISH VERSION

- 1 Answer any 10 out of 20 multiple choice questions 15
 given below : (1.5 marks each)
- (1) What type of transactions are recorded in the accountancy ?
 (A) Non-economic (B) Economic
 (C) Both (A) and (B) (D) Not even one
- (2) Sequence the accounting steps :
 (1) Trial balance sheet
 (2) Journal from voucher
 (3) Annual accounts
 (4) Ledger - posting
 (A) (2), (4), (3), (1) (B) (2), (3), (4), (1)
 (C) (2), (4), (1), (3) (D) (2), (1), (3), (4)

- (3) The discovery of what removed the limits of barter system ?
 (A) Accountancy (B) of money
 (C) of accounts (D) farming
- (4) What are the goals that can be achieved in an hour ?
 (A) Specific (B) General
 (C) Both (A) and (B) (D) Not even one
- (5) "Students prepare cash book with precision". - What is the purpose of this ?
 (A) Knowledge (B) Understanding
 (C) Application (D) Skill
- (6) Which step comes after teaching in Microteaching ?
 (A) Re-teach (B) Feedback
 (C) Re-planning (D) Evaluation
- (7) Which of the following characteristics is a good question ?
 (A) Short and clear
 (B) Long enough
 (C) Containing at least fifteen words
 (D) More than one answer
- (8) When should a teacher do black board work ?
 (A) Five minutes before the hour ends
 (B) As well as lesson development
 (C) At the beginning of the hour
 (D) Any time
- (9) How many minutes are there of the bridge lesson ?
 (A) 5 to 10 (B) 15 to 20
 (C) 35 to 40 (D) 10 to 15
- (10) Which lesson use different skills in an integrated way ?
 (A) Bridge lesson (B) Micro lessons
 (C) Story lesson (D) Unit lesson
- (11) Who was the pioneer of project method ?
 (A) Socrates (B) Herbert
 (C) Kill Patrik (D) Meshlo
- (12) Questions of self-study what should be the vision of grammar ?
 (A) Clear (B) Short
 (C) Both (A) and (B) (D) Not even one
- (13) In which method is the concept of "abstract to tangible" ?
 (A) Induction (B) Project
 (C) Assignment (D) Deduction
- (14) What is the center of the problem solving system ?
 (A) Teacher (B) Society
 (C) Problem (D) Principal

- (15) Which word means to divide the problem ?
 (A) Conjugation (B) Induction
 (C) Deduction (D) Analysis
- (16) What is the importance of education device ?
 (A) To inovate in education
 (B) To embody abstract concepts
 (C) To make the teaching process interesting
 (D) All given
- (17) What is the width of the pictures in the film strip ?
 (A) 10 mm. (B) 35 mm.
 (C) 10 cm. (D) 50 cm.
- (18) What is the most effective mass medium of the present time ?
 (A) Tape-recorder (B) Television
 (C) Radio (D) Film strip
- (19) What kind of educational tool are charts ?
 (A) Audible (B) Visual
 (C) Audio visual (D) Not even one
- (20) Which of the following is a useful journal in Book keeping education ?
 (A) Budgeting
 (B) Tax business
 (C) Economic development
 (D) All

2 Answer any 04 out of eight (8) questions given below : **20**

(Five marks each)

- (2.1) Explain the importance of accountancy of higher secondary level.
- (2.2) Explain the goals of "Accountancy" subject education by stating the concept of the goal.
- (2.3) Explain the concept of Microlesson. Prepare a black board work skill of micro lesson.
- (2.4) Expalin concept of bridge lesson. Explain the difference between microteaching and bridge lesson.
- (2.5) Explain the steps of project method.
- (2.6) Discuss the meaning of assignment method and explain its merit-demerits.
- (2.7) Explain the importance of charts and reference books as an educational tool.
- (2.8) Give the concept of film strip. What pre-preparation should be done for its use ?

EC-10 : Economics Method

- ૧ નીચે આપેલા ૨૦ બહુવિકલ્પી પ્રશ્નો પૈકી કોઈપણ ૧૦ના ઉત્તર આપવા : ૧૫
(પ્રત્યેકનો ૧.૫ માર્ક્સ)
- (૧) અર્થશાસ્ત્રમાં કઈ બાબતનો અભ્યાસ કરવામાં આવે છે ?
(A) ઉત્પાદન (B) વપરાશ
(C) વિનિમય (D) બધા જ
- (૨) અર્થશાસ્ત્ર સ્વભાવથી જ ગણિત વિષયક છે. - આ વિધાન કોનું છે ?
(A) જેવન્સ (B) માલ્થસ
(C) કેઈન્સ (D) માર્શલ
- (૩) પ્રોજેક્ટમાં કેવું મૂલ્યાંકન હોય છે ?
(A) લેખિત (B) સતત
(C) મૌખિક (D) આ બધા જ
- (૪) કઈ પદ્ધતિ 'ક્રિયા દ્વારા શિક્ષણ' પર ભાર મૂકે છે ?
(A) સ્વાધ્યાય (B) આધાર
(C) મુલાકાત (D) પ્રોજેક્ટ
- (૫) આલેખ શાની દૃશ્ય રજૂઆત છે ?
(A) માહિતી (B) ચિત્રો
(C) આંકડાઓ (D) આ બધા જ
- (૬) અર્થશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે ?
(A) સંકુલ (B) સામાજિક
(C) શુદ્ધ (D) વ્યવહારું
- (૭) શૈક્ષણિક સાધન શાના માટે વધુ લાભદાયી છે ?
(A) બુદ્ધિ (B) ધારણ
(C) પ્રેરણા (D) સફળતા
- (૮) માર્કો ટીચીંગનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો ?
(A) ડ્વાઈટ એલન (B) બી.કે. પાસી
(C) સ્ટીફન કોરે (D) એકપણ નહીં
- (૯) પ્રોજેક્ટ પદ્ધતિનું છેલ્લું સોપાન કયું છે ?
(A) જૂથ અહેવાલ (B) અમલ
(C) આયોજન (D) મૂલ્યાંકન
- (૧૦) પાઠ આયોજનનું સૌપ્રથમ સોપાન કયું છે ?
(A) સ્વાધ્યાય (B) પ્રારંભિક માહિતી
(C) વિષયાભિમુખ (D) કા.પા. કાર્ય

- (૧૧) નીચેનામાંથી કયું સાધન દૃશ્ય-શ્રાવ્ય નથી ?
- (A) ફિલ્મ (B) ટી.વી.
(C) ફિલ્મ સ્ટ્રીપ (D) કમ્પ્યુટર
- (૧૨) નીચેનામાંથી કઈ પદ્ધતિ વૈચારિક પદ્ધતિ છે ?
- (A) સમસ્યા ઉકેલ પદ્ધતિ (B) સ્વાધ્યાય પદ્ધતિ
(C) કથન પદ્ધતિ (D) પ્રોજેક્ટ પદ્ધતિ
- (૧૩) તાલીમાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા કયા પાઠો જરૂરી છે ?
- (A) સેતુ પાઠ (B) છૂટા પાઠ
(C) માઈક્રો પાઠ (D) વાર્ષિક પાઠ
- (૧૪) ચાર્ટ્સને અસરકારક બનાવવા તેમાં રજૂઆત કેવી રીતે કરવી જોઈએ ?
- (A) શાબ્દિક (B) રૈખિક
(C) ચિત્રાત્મક (D) આ બધા જ
- (૧૫) પાઠ આયોજનના મુખ્ય પ્રકાર કેટલાં છે ?
- (A) ૪ (B) ૬
(C) ૭ (D) ૩
- (૧૬) માઈક્રો પાઠની સમય મર્યાદા કેટલી હોય છે ?
- (A) ૧૭ મિનિટ (B) ૫ મિનિટ
(C) ૩૦ મિનિટ (D) ૨૦ મિનિટ
- (૧૭) સામાન્ય રીતે ફિલ્મ સ્ટ્રીપની પહોળાઈ કેટલી હોય છે ?
- (A) ૭૦ મિમી (B) ૨૫ મિમી
(C) ૩૦ મિમી (D) ૩૫ મિમી
- (૧૮) નીચેનામાંથી કોનો સમાવેશ ચાર્ટ્સના પ્રકારમાં થતો નથી ?
- (A) સમય ચાર્ટ્સ (B) વિકાસ ચાર્ટ્સ
(C) નમૂના ચાર્ટ્સ (D) વૃક્ષ ચાર્ટ્સ
- (૧૯) નીચેનામાંથી કયું શૈક્ષણિક સાધન દૃશ્ય નથી ?
- (A) ટી.વી. (B) બ્લોક-બોર્ડ
(C) કમ્પ્યુટર (D) રેડિયો
- (૨૦) સૌથી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ કઈ છે ?
- (A) પ્રોજેક્ટ પદ્ધતિ (B) સ્વાધ્યાય પદ્ધતિ
(C) સમસ્યા ઉકેલ પદ્ધતિ (D) પ્રવચન પદ્ધતિ

- ૨ નીચે આપેલા ૮ પ્રશ્નો પૈકી કોઈ પણ ૪ ના ઉત્તર આપો : (પ્રત્યેકના ૫ માર્ક્સ) ૨૦
- (૧) વ્યક્તિના જીવનમાં અર્થશાસ્ત્રનું મહત્વ સમજાવો.
- (૨) માઈક્રોટીરિયોગની ચર્ચા નીચેના મુદ્દાઓના સંદર્ભમાં કરો :
 – સંકલ્પના
 – મહત્વ
- (૩) પ્રોજેક્ટ પદ્ધતિનો અર્થ આપી તેના સોપાનો સમજાવો.
- (૪) નીચે જણાવેલ શૈક્ષણિક સાધનો અર્થશાસ્ત્ર વિષયમાં કઈ રીતે ઉપયોગી બની શકે છે.
 – ટેલિવિઝન
 – રેડિયો
 – ફિલ્મ સ્ટ્રીપ
- (૫) અધ્યાપનના સામાન્ય હેતુઓ સમજાવો.
- (૬) સુદૃઢીકરણ કૌશલ્યનાં ઘટકો સ્પષ્ટ કરો.
- (૭) શૈક્ષણિક ઉપકરણોનું મહત્વ જણાવો.
- (૮) સ્વાધ્યાય પદ્ધતિનો અર્થ આપી તેના લાભ-ગેરલાભ સમજાવો.

ENGLISH VERSION

- 1 Answer any 10 out of the following 20 MCQ questions : 15
 (1.5 marks each)
- (1) Which things are studied in Economics ?
 (A) Manufacturing (B) Consumption
 (C) Exchange (D) All
- (2) Economics is numerical by Nature. Who said this ?
 (A) Jevans (B) Malthus
 (C) Keynes (D) Marshall
- (3) Which type of evaluation is in project ?
 (A) Written (B) Continuous
 (C) Oral (D) All
- (4) Which method 'Emphasis on Learning by doing' ?
 (A) Exercise (B) Source
 (C) Interview (D) Project

- (5) Graph is visual presentation of _____ .
 (A) Information (B) Pictures
 (C) Data (D) All
- (6) Which type of Science is Economics ?
 (A) Complex (B) Social
 (C) Pure (D) Applied
- (7) For what teaching aids are more useful ?
 (A) Intelligence (B) Retention
 (C) Motivation (D) Success
- (8) Who gave the concept of Micro teaching very first time ?
 (A) Dwight Allen (B) B.K. Passi
 (C) Stephen Corey (D) None
- (9) Which is the last step of project method ?
 (A) Group Report (B) Application
 (C) Planning (D) Evaluation
- (10) What is the first step of lesson planning ?
 (A) Assignment (B) Preliminary Information
 (C) Introduction (D) Black-Board work
- (11) Which of the following educational aids is not Audio-Visual aids ?
 (A) Film (B) T.V.
 (C) Film strip (D) Computer
- (12) Which of the following method is a intellectual method ?
 (A) Problem solving method
 (B) Assignment method
 (C) Lecture method
 (D) Project method
- (13) Which lessons are necessary for the self confidence of trainees ?
 (A) Bridge lesson (B) Stray lesson
 (C) Micro lesson (D) Annual lesson
- (14) How is the presentation in chart can make it more effective ?
 (A) Verble (B) Linear
 (C) Graphical (D) All
- (15) How many types of main lesson planning are there ?
 (A) 4 (B) 6
 (C) 7 (D) 3

- (16) How much time limit does a micro lesson has ?
 (A) 17 minutes (B) 5 minutes
 (C) 30 minutes (D) 20 minutes
- (17) How is the broad size of Film strip generally ?
 (A) 70 MM. (B) 25 MM.
 (C) 30 MM. (D) 35 MM.
- (18) Which of the following is not included in the types of charts ?
 (A) Time charts (B) Development charts
 (C) Model charts (D) Tree charts
- (19) Which of the following Educational aid is not visual ?
 (A) T.V. (B) Black-Board
 (C) Computer (D) Radio
- (20) Which is the oldest method of Education ?
 (A) Project method
 (B) Assignment method
 (C) Problem - solving method
 (D) Lecture method

2 Answer any 4 out of the following 8 questions : (5 marks each) **20**

- (1) What is the importance of Economics in the life of person ?
- (2) Discuss the micro-teaching with following points :
 — Concept
 — Importance
- (3) Give the meaning of project method and explain its steps ?
- (4) How to use the following teaching aids are useful in economics teaching ?
 — Television
 — Radio
 — Film-stripe
- (5) State general objectives of teaching.
- (6) Specify the components of skill of Reinforcement.
- (7) State the importance of teaching aids.
- (8) Give the meaning of assignment method ? Explain its advantage and disadvantage.

**EC-11 : Business Management &
Administration Method**

- ૧ નીચે આપેલા ૨૦ બહુવિકલ્પી પ્રશ્નો પૈકી કોઈપણ ૧૦ના ઉત્તર આપો. ૧૫
(પ્રત્યેકનો ૧.૫ માર્ક્સ)
- (૧) “વાણિજ્ય એટલે વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓનો સમૂહ” આ વિધાન કોનું છે ?
(A) પાલેકર (B) સાવકાર
(C) થોમસ (D) એકપણ નહીં
- (૨) કયા હેતુઓ લાંબા ગાળે સિદ્ધ થાય છે ?
(A) સામાન્ય (B) વિશિષ્ટ
(C) બંને (D) એકપણ નહીં
- (૩) વ્યક્તિના રોજબરોજના જીવનમાં વાણિજ્યના જ્ઞાનની જરૂરિયાત ઊભી થાય છે. આ વાણિજ્ય શિક્ષણનો કયો ઉદ્દેશ ધરાવે છે ?
(A) જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય
(B) ઉપયોગિતાનું ધ્યેય
(C) માનવ શક્તિનું ધ્યેય
(D) આંતરરાષ્ટ્રીય દષ્ટિકોણ વિકાસનું ધ્યેય
- (૪) એક તાસના અંતે વિદ્યાર્થીમાં જોવા મળતા ફેરફારને શું કહેવાય ?
(A) સામાન્ય હેતુ (B) અપેક્ષિત વર્તન પરિવર્તન
(C) ધ્યેય (D) વિશિષ્ટ હેતુ
- (૫) વિદ્યાર્થીઓ વેપારના અર્થ વિશે જાણે. આ કયો હેતુ દર્શાવે છે ?
(A) જ્ઞાન (B) સમજ
(C) ઉપયોજન (D) કૌશલ્ય
- (૬) માઈક્રોટીચીંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
(A) સેતુ પાઠ (B) સાદા પાઠ
(C) સૂક્ષ્મ અધ્યાપન (D) તાસ પાઠ
- (૭) કયો પાઠ કૃત્રિમ વર્ગખંડ પરિસ્થિતિમાં લેવાય છે ?
(A) છૂટો પાઠ (B) એકમ પાઠ
(C) સાદા પાઠ (D) સેતુ પાઠ
- (૮) શિક્ષક શિક્ષણ કાર્ય શરૂ કરતા પહેલાં વિદ્યાર્થીઓમાં નવું જ્ઞાન મેળવવા જિજ્ઞાસા જાગૃત કરે, તે કયું કૌશલ્ય છે ?
(A) સુદૃઢીકરણ (B) પ્રશ્નકૌશલ્ય
(C) વિષયાભિમુખ (D) ઉદાહરણ કૌશલ્ય

- (૯) કા.પા. કાર્યના અગત્યની બાબતો, મુદ્દા, પેટામુદ્દા દર્શાવવા શાનો ઉપયોગ કરવો જોઈએ ?
- (A) પોઈન્ટર (B) ડસ્ટર
(C) રંગીન ચોક (D) ફૂટપટ્ટી
- (૧૦) બાષ્પીભવન એકમ શીખવતા શિક્ષક ચોમાસામાં કપડા જલ્દી સૂકાતાં નથી. એવું જણાવે છે. શિક્ષકે કયા અધ્યાપન કૌશલ્યનો ઉપયોગ કર્યો ?
- (A) કથન (B) ચર્ચા
(C) સુદૃઢીકરણ (D) ઉદાહરણ
- (૧૧) કઈ પદ્ધતિ પ્રાચીન પદ્ધતિ તરીકે ઓળખાય છે ?
- (A) પ્રોજેક્ટ (B) વ્યાખ્યાન
(C) નિદર્શન (D) સમસ્યા ઉકેલ
- (૧૨) વિદ્યાર્થી જાતે અધ્યયન કરતો થાય, જાતે કૌશલ્યનો વિકાસ કરતો થાય. એવો મૂળભૂત હેતુ કઈ પદ્ધતિનો છે ?
- (A) આગમન (B) નિગમન
(C) નિદર્શન (D) સ્વાધ્યાય
- (૧૩) પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા જણાવો.
- (A) જહોન ડ્યૂઈ (B) કિલ પેટ્રીક
(C) લેબાર્ડ (D) રાયબન
- (૧૪) “મૂર્તથી અમૂર્ત”નો ખ્યાલ કઈ પદ્ધતિમાં છે ?
- (A) નિગમન (B) સ્વાધ્યાય
(C) પ્રોજેક્ટ (D) આગમન
- (૧૫) સમસ્યા ઉકેલ પદ્ધતિમાં સમસ્યાનો ઉદ્ભવ કોના દ્વારા થાય તે વધુ ઈચ્છનીય ગણાય ?
- (A) શિક્ષક (B) વિદ્યાર્થી
(C) આચાર્ય (D) વાલી
- (૧૬) વિદ્યાર્થીની તર્કશક્તિ અને ઉપચારશક્તિ ખીલવવા ઉપયોગી પ્રયુક્તિ કઈ છે ?
- (A) પ્રશ્નોત્તર (B) કથન
(C) વર્ણન (D) મુલાકાત
- (૧૭) કોઈ એક મુદ્દાની વિસ્તૃત અને કાલ્પનિક રજૂઆતને શું કહેવાય ?
- (A) કથન (B) ચર્ચા
(C) વર્ણન (D) મોજણી

(૧૮) રેડિયો, ટેપરેકોર્ડર કેવા પ્રકારના સાધનો છે ?

- (A) દ્રશ્ય (B) શ્રાવ્ય
(C) દ્રશ્ય-શ્રાવ્ય (D) એકપણ નહીં

(૧૯) સામાન્ય રીતે એક ફિલ્મ સ્ટ્રીપમાં કેટલા ચિત્રો હોય છે ?

- (A) ૧૦ થી ૧૫ (B) ૧૦૦ થી ૧૫૦
(C) ૨૦ થી ૨૫ (D) ૫૦ થી ૧૦૦

(૨૦) કોને અત્યારની આધુનિક ટપાલ કહેવાય છે ?

- (A) ઈ-મેઇલ (B) પત્રો
(C) દસ્તાવેજો (D) સામયિકો

૨ નીચે આપેલા ૮ પ્રશ્નો પૈકી કોઈપણ ૪ ના ઉત્તર આપો. (પ્રત્યેકના ૫ માર્ક્સ) ૨૦

(૨.૧) ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વાણિજ્ય શિક્ષણના ઉદ્દેશો સવિસ્તર જણાવો.

(૨.૨) વાણિજ્યનું કાર્યક્ષેત્ર સમજાવો.

(૨.૩) માઈક્રોટીચીંગ - સેતુપાઠ વચ્ચેનો તફાવત સમજાવો.

(૨.૪) કા.પા. કાર્ય કૌશલ્યના ઘટકો વિગતે સમજાવો.

(૨.૫) વાણિજ્ય એકમ આધારિત પ્રોજેક્ટ પદ્ધતિના સોપનો સમજાવો.

(૨.૬) વાણિજ્ય શિક્ષણમાં આગમન અભિગમ અંગે નીચેના મુદ્દા ચર્ચો :

- સંકલ્પના
- લાભાલાભ

(૨.૭) ઈ-મેઇલ અને ઈન્ટરનેટનું મહત્ત્વ સમજાવો.

(૨.૮) નીચે આપેલી પ્રયુક્તિઓનો અર્થ આપી, વાણિજ્ય શિક્ષણમાં તેની જરૂરિયાત જણાવો.

- મુલાકાત
- ચર્ચા.

ENGLISH VERSION

1 Answer any 10 out of the 20 multiple choice questions given below. (1.5 marks each) **15**

- (1) "Commerce means a set of ancillary services in addition to trade". Who said this ?
 - (A) Palekar
 - (B) Savkar
 - (C) Thomas
 - (D) Not even one
- (2) Which objectives are achieved in the long run ?
 - (A) General
 - (B) Exclusive
 - (C) Both
 - (D) Not even one
- (3) Knowledge of commerce arises in the daily life of a person. What is the purpose of this commerce education ?
 - (A) The goal of acquiring knowledge
 - (B) The goal of utility
 - (C) The goal of human power
 - (D) The goal of developing an international outlook
- (4) What called is the change seen in the student at the end of an hour ?
 - (A) General purpose
 - (B) Expected behaviour change
 - (C) The goal
 - (D) Special purpose
- (5) The student knows the meaning of trade. What is the purpose of this ?
 - (A) Knowledge
 - (B) Understanding
 - (C) Utility
 - (D) Skill
- (6) By what other name is micro teaching known ?
 - (A) Bridge lesson
 - (B) Plain text
 - (C) Subtle lesson
 - (D) Hour lesson
- (7) Which lesson is taken in an artificial classroom situation ?
 - (A) Stray teaching
 - (B) Unit lesson
 - (C) Plain text
 - (D) Bridge lesson

- (8) What is the skill of the teacher to arouse the curiosity of the students to acquire new knowledge before starting the teaching work ?
(A) Consolidation (B) Question skills
(C) Subject oriented (D) Example skills
- (9) What should be used to highlight the important points, issues, sub-issues of the black board work ?
(A) Pointer (B) Duster
(C) Colored Chalk (D) Scale
- (10) The teacher teaching the evaporation unit states that clothes do not dry quickly in the monsoon. the teacher used the which ?
(A) Statement (B) Discussion
(C) Consolidation (D) Example
- (11) Which system is known as the ancient system ?
(A) Project (B) Lecture
(C) Demonstration (D) Problem solved
- (12) What is the basic purpose of the system as the student studies own self and develops his skills ownself ?
(A) Inductive (B) Deductive
(C) Demonstration (D) Exercise
- (13) Name the Pioneer of the project method.
(A) John Dewey (B) Kill Patrick
(C) Labard (D) Ribbon
- (14) In which method is the concept of “tangible to intangible” ?
(A) Deductive (B) Exercise
(C) Project (D) Inductive
- (15) In problem solving system it is more desirable to create the problem by whom ?
(A) Teacher (B) Student
(C) Principal (D) Guardian
- (16) Which is useful technique to develop the student's reasoning power and thinking power ?
(A) Q & A (B) Lecture
(C) Description (D) Visit

- (17) What called is a detailed and imaginative presentation of a single issue ?
(A) Lecture (B) Discussion
(C) Description (D) Survey
- (18) What kind of equipment is a radio, a tape recorder ?
(A) Visible (B) Audible
(C) Visible-Audible (D) Not even one
- (19) How many pictures are usually in a film strip ?
(A) 10 to 15 (B) 100 to 150
(C) 20 to 25 (D) 50 to 100
- (20) What is Modern postage ?
(A) E-Mail (B) Letter
(C) Documents (D) Magazines

2 Answer any four (4) out of the eight (8) questions given **20**
below : (Five marks each)

- (2.1) Explain in detail the objectives of commerce education of higher secondary level.
- (2.2) Explain the scope of commerce.
- (2.3) Explain the difference between a micro lesson and a bridge lesson.
- (2.4) Explain in detail the components of a black board work skill.
- (2.5) Explain : the steps of project method in the based of commerce unit.
- (2.6) Discuss following points for inductive method :
— Concept
— Merits - Demerits
- (2.7) Explain the importance of E-mail and internet.
- (2.8) Explain the meaning and the need for the following techniques in commercial education.
— Visit
— Discussion.